



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૫/૦૬/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૭૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૪ કેસ કરી, ૫૨ વ્યક્તિઓને ઝડપી, ૧૫૭ લીટર દેશી દારૂ, ૩૧૩ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૧૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૧,૯૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૭૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૮૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપિંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૦૭૫/૧૯

બાપુનગર: ચરૂમતીબહેન વા/ઓ માધવન પિલ્લઈ (ઉ.વ.૬૮)(રહે.ગુ.હા.બોર્ડ રાધાભક્તિ નર્સિંગ હોમ સામે બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૨૪/૦૬/૧૯ કલાક ૧૧/૦૦ થી બપોરના ૧/૦૦ વાગ્યા દરમ્યાન એક અજાણી સ્ત્રી (રેખાબેન પટેલ) (જેના પુરા નામ-ઠામની ખબર નથી) એ ચરૂમતીબહેનને પેન્શન અપાવવાની લાલચ આપી, રીક્ષામા બેસાડી જુદી-જુદી જગ્યાએ ફેરવી, પાલડી સુશ્રુત હોસ્પિટલ ખાતે રિપોર્ટ કઢાવવા બેસાડી તેમની સોનાની બે બંગડી અને બે સોનાની બુટ્ટી તથા એક સોનાની વીંટી મળી કુલ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- તેમજ અગત્યના દસ્તાવેજો સાથેનું પાકીટ લઈ નાસી જઈ ચરૂમતીબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.રાહોડ યલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૧૦૭૬/૧૯

નરોડા: અંકીતભાઈ સોમાભાઈ પટેલ (ઉ.વ.૩૪)(રહે.મનોહર વિલા સોસાયટી, ચાર રસ્તા પાસે કૃષ્ણનગર) તા.૨૩/૦૬/૧૯ રાતના ૧૦/૪૫ વાગ્યાના સુમારે નરોડા નિલકંઠ ફ્લેટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ એક પુરૂષ અંકીતભાઈના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ અંકીતભાઈ પટેલે નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.મોરી યલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૭૭/૧૯

ગોમતીપુર: રાહુલ અમૃતભાઈ વાઘેલા (ઉ.વ.૨૧) (રહે. શેઠ કોઠાવાળા વોરાની ચાલી પુતરાવાળી ગલી મંદિરના છાપરા ડી-૩૦ દવાખાનાની સામે ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૨૩/૬/૧૯ બપોરના ૨/૦૦ થી તા.૨૪/૬/૧૯ કલાક ૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં ટુવાલ બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એમ.મેકવાન ચલાવે છે.

ઓઢવ: પીન્ડુભાઈ અશોકભાઈ ચુનારા (ઉ.વ.૩૦) (રહે. ઇન્દિરાનગરના છાપરાં અમૃત વિદ્યાલયની બાજુમાં ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૨૪/૬/૧૯ કલાક ૯/૧૫ વાગ્યાના સુમારે કડીયાનાંકા સામે કંપાઉન્ડમાં ઝાડ સાથે દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પલાસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.